

## Acknowledgement

નેવેન્દ્રનાના

આ મહાત્મનંબંધ વિષે કેટલીક વાયતો કહેવાની રહે છે. સર્વપ્રથમ તો, એની મર્યાદા - વ્યાપ વિષે એ ૩૫૭૮ કરવાનું છે કે મહાત્માજીવ કાલિદાસના અદ્ભુત ઓકર્ષણે જે સાહિત્યરસિક સર્જકોનું ધ્યાન ગેયી તેમને, તેમની કૃતિઓના, સાક્ષરહેતુને લીધે અનુવાદ કરવા પ્રેયું, તેમના તેવા અનુવાદોનો જ આ અસ્યાસમાં સમાવેશ કર્યો છે. લેમાં પણ પ્રગટ થયેલી કૃતિઓ તરફ જ ધ્યાન આપ્યું છે. હજ અપ્રગટ રહેલું સાહિત્ય પણ હોય, પરંતુ તેના આ અસ્યાસની મર્યાદામાં સમાવેશ કર્યો નથી. સાઈજ રીતે કોઈ હસ્તપ્રત મળી આવી ત્યાં તેનો અસ્યાસ કર્યો છે.

પ્રયત્ન કરવા છતાં, એહની વાત હે કે નીચેના અનુવાદો મળ્યા નથી.

: ૧: શ્રી જમશેદજ ઉમરીગરનો શાહુન્તલનો અનુવાદો તેને વિષે શ્રી વલ્લવંતરાય ક. ઠાકોર નોંધે છે: "પ્રસ્તગોપાત નોંધું છું કે કાઠયાવાડના એક જુના માસિકની ફાઇલોમાં જમશેદજ ઉમરીગરનો લગેલો કાલિદાસકૃત શાહુન્તલા નાટકનો તરજુમો પડેલો છે. ગુજરાત વર્ણાખ્યાલર સોસાયટી કે ફર્મિશસભા જેવી સ્વસ્થા એને ચોપડી રૂપે પ્રગટ કરે તો શાહુન્તલાના વાચકોને વાંચવો ચારી પેઠે ફાવે તેવો એ તરજુમો છે.

: ૨: માલવિકાર્ણિભ્ર નાટકના<sup>૨</sup> એક અનુવાદની નોંધ શ્રી રસિકલાલ છો. પરીએ લીધો છે. <sup>તૃદી</sup>

૧: પ્રવેશકો ગુણ - ૧ પુ. ૧૩૧ - ફુટનોંટ.

૨: પ્રસ્થાન ૧૯૮૮ : પુ. ૧૬ સુઃ પુ. ૨૬૯

## ગુજરાતી સમાજના દ્વારા.

નો કરેલો છે. સંબંધિતરાચ ક. ઠાકોરના "માલંવિકા" અનુવાદનું અવલોકન કરતાં તે નોંધે છે કે તે અનુવાદ તેમને મળયો ન હતો. મને પણ તે મળયો નથો.

: 3: સંબ. ડાહયાભાઈ પાતંબરદાસ હેરાસરી નોંધે  
છે: સં. હ. ઝ. ધૂલે માર્ગ પૂર્વમેલનું સમકલોકની સુદર ભાષાંતર  
કર્યું હતું. ઉત્તરમેધનું ભાષાંતર થઈને એ કાચ્ય પૂર્ણ થયું નથી  
એ શોચનાય છે.

મહાકાવ કાલિકાશની કૃતિઓ જુદી જુદી  
શુન્નત સ્થિતીઓના અભ્યાસકામમાં નિયત કરવામાં આવે છે.—  
તેવી કૃતિઓની, વિશ્વાશીઓને ઉપયોગી થાય તેવાં સંપાદન  
જેમ જુદી જુદી ભાષાઓમાં થાય કરતાં હોય હે તેમ  
ગુજરાતીમાં પણ થાય છે. ત્યાં પાઠ્યપુસ્તકનું સંપાદન  
કરવાનો હેતુ મુખ્ય હોય છે, સાક્ષરહેતુ નથી હોતો. ગુજરાતીમાં  
એવી ધ્યાન આવૃત્તિઓ થઈ છે. તેનો પણ આ અભ્યાસમાં  
સમાવેશ કર્યો નથી. આવાં સંપાદનોમાં કાલિકાશવિષયક —  
તેમના સમય, જીવન, વ્યાચતત્વ અને સર્જનવિષયક વિચારણ।  
પ્રક્રિયાવના, નોંધ, વિવરણ કે ટિપ્પણીમાં કરવામાં આવે છે.  
તેના સંપાદકોની નજર સામે સાક્ષરહેતુથી થયેલા અનુવાદો  
પડુયા હોય છે. આવશ્યકતાનુસાર તેણો તેનો ઉપયોગ કરવા  
હોય છે. તેમ છતાં તેમનો પોતાનો મુખ્યહેતુ સંપાદનનો  
હોય છે, સાક્ષરહેતુ નહોં, તેથી તેમ જ વિષયની બોકુકુસ  
મયર્દા જાળવાય તે હેતુથી તે કૃતિઓને આ અભ્યાસમાંથી —  
તેની ભયર્દામાંથી બહાર રાણી છે.

.. પ્રણ..

આ મહાકવિની મોહક દૃતિઓના - ફરેઝના

- એકથી વધુ ગુજરાતી અનુવાદો થયા છે. તેનો સમય અનુભવે  
વિચાર કરેલો હોવાથી, ધ્યાનિવખત અમુક વિચારો કે વિધાનોની  
પુનરૂચિત, વ્યાખ્યાવિક રીતે જ થઈ છે. રથો રથો તે જરૂરી  
લાગી છે તેથી જ તે રહેવા દીધી છે. એમકે, મેધાતના  
અનુવાદોની યર્યા વિચારણા કરતાં તે અનુવાદોનું મૂલ્યાંકન  
કરવાનો પ્રયાસ કરતાં જે વિધાનો કર્યો હોય તે, તે  
પૂરુષાને આતે સમગ્રતયા વિચાર કરતાં પણ કરવાં પડ્યું છે. તે  
જ રીતે બીજી અનુવાદોના વિચારમાં પણ બન્ધુ છે. ગુજરાતી  
અને સૌસ્કૃત ભાષાની લિખન પ્રકૃતિ, અનુવાદકોને પડેલી મુજવા  
અને તેનો ઉકેલ લાવવા તેમણે કરેલી મથ્યામળ વગેરે શેંપળ  
પુનરૂચિત થઈ હોય ત્યાં તે જરૂરી છે, માટે રહેવા દીધી છે.  
અનુભાવમાં રહી-થઈ છે એમ નહિ. અથાચ્યાને તે બતાવવાની  
પ્રયત્નપણ કર્યો છે.

છેલ્સે એક ગ્રાત્યાત્ર આનંદદાયક ફરજ બનવાની  
રહ્યે છે. હરકોઈ વિષયનો અન્યાસ કરતાં, તે પહેલાં તે વિષયમાં  
ને કાર્ય થશ્યું હોય, તેનો લાભ અભ્યાગીને મળતો જ હોય છે,  
તેની છાયા તેના કાર્યપર પડે જ છે, તેમાંથી તેને દિશાસ્થાન  
પણ મળે છે. આ અભ્યાસમાં ને ને પુસ્તકો, વિવેચનકેળો,  
મૂલ્યાંકન આનંદનો પ્રત્યક્ષ કે પરોક્ષરીતે કે/ ઉપયોગ કર્યો છે  
તે વધાના લોઙ્કો - વિદ્વાનોના આત્માત આનંદદાયક કાર્ય,  
તેમનો અધ્યાત્મીકાર હું દૃતજ્ઞ હૃદયે કરું છું: જીન સમગ્રતયા  
એક ન છે, તેનો વારસો સૌનો સહિયારો છે, જે નહું  
કાર્ય એ ક્ષેત્રમાં થાય છે તે વધા વિવાપ્રેભીઓનો સહિયારો  
વારસો જ બને છે, તેવું જ અહીં પણ છે. અહીં પણ પ્રત્યક્ષ કે

પરોક્ષ રીતે આજસુધીના વિદ્વાનોના કાર્યનો લાભ  
મળ્યો જ છે. તે ઉપરાંત કેટલુંક વિશેષ અનુષ્ઠાનિક  
સ્વીકારવાનું રહે છે. તેની આ તકલિ હું.

મહારાજ વિદ્વાની યુનિવર્સિટીના  
ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રાદ્યપક તથા  
પ્રાચ્યવિદ્યામંહિરના નેચામક ડૉ. ભોગીલાલ જ. સંડેસરાણી  
જ મને આ વિષય સુચવેલો, તે બાબતના લાભો ઇતિહાસની  
વગતોમાં જરૂર અહોં અથને છે. તે વિષય મને અનુકૂળ નિવિદ્યો  
છે. ના કાર્યમાં અંગતરસ લઈને તેમને ધ્યાન વણત મને ઉપયોગી  
સુચનાઓ કરી છે અને ધ્યાન કૃતાંતો પણ મેળવી આપો છે.  
તેનો સ્વીકાર કરતાં અને તેમનો આભાર માનતાં મને  
અત્યંત અનુભૂતિ થાય છે. વારેવાર પ્રેરણ આપ્યા કરતાં  
તથા અતરંગ સ્વજન અની રહેલા, જ્યારે અને કેટલો સમય  
નેહાં ત્યારે ને કેટલો સમય આપનાર મારા માર્ગદર્શક  
ડૉ. શ્રી રજાજિતભાઈ મો. પટેલનો તો કથા શાંખોમાં  
આભાર માનવો તે પણ સમજતું નથી, તેમને એ વિધિ ગમશે  
ય નહોં, એટલે એ ઊમને અનુકૂળ રાખવી તે જ સરો માર્ગ  
છે. મુશ્કી અન્તરાય મ. રાવજલાહેય પારેથી એ અનેકવાર  
ઉમળકા અને સૌજન્યસ્થું માર્ગદર્શન મળ્યું છે. તેમનો પણ  
આભારવશ હૃદયે ઉપકાર માર્ગ હું. પ્રા. શ્રી ઉમાશક્રભાઈ  
બેશીએ મારા કાર્યમાં અંગત રહ્યે કાંઈ, તેમની પાણેની એક  
હુક્તપ્રત મને ઉપયોગ કરવા આપો હસ્તી, એ દ્વારા કૃતિઓ  
વિશે માટેલી આપો તે મને પ્રાપ્ત કરી આપી છે. તે  
આત્મીયતા ભરી જમતા બદલ તેમનો, એક મુલ્યવાન  
સુચન કરવા માટે આચાર્ય શ્રી યશવંતભાઈ શુભ્લનો, મારા  
પ્રાદ્યપક મુખ: શ્રી રામયન્દ બ. આધ્યાત્મિક હેઠાં તથા પ્રા.

અનુમતાદ્વારા ભટ્ટસાહેયનો, ડૉ: જયહેવભાઈ શુક્લ, મુખ્ય શ્રી  
મુળથીકર મો. આજીંક આર્ટેડ સાધેની અવારનવાર થતી  
અચાન્યોભાંથી પગ મને શુદ્ધનો જે પ્રોત્સાહન મળ્યું છે.  
તે વધુંનો હું આસારમાંનું હું.

વડોદરાના શ્રી રમણીકરાય શ્રીપતરાય  
દેશાઈ વિવિધ પ્રકારનાં જુનાં નવાં પુસ્તકોના ચંગ્રહનાં  
ભારે શોખાન છે. તેમની પાસેથી કાલદાસની કૃતિઓનાં  
અનુવાદની માહેતી તો મળો જ, તે ઉપરાંત પોતાના  
ચંગ્રહમાંથી ૧૧ કૃતિઓ, સાતાઠો માઝના લાંબા ગાળા  
માટે ઉદ્ઘરતાપૂર્વક ઉપયોગ કરવા માટે તેમણે મને આપી  
પણ ખરી. તે માટે તેમનો આભારી હું. મુલાઈનિવાસી  
શ્રી તનમનીશકર લા. શ્વારે તેમના કુમારચંદ્રવના રાગ  
પાંચમાના અનુવાદની હસ્તપ્રચિન્તા મોકલી આપી, શ્રી  
યુલાખીરામ ર. પંડ્યા - ૮૮ વર્ષના વયોવૃદ્ધિ ચક્ષરે -  
મેધૈદૂત તથા અજવલાપનો અનુવાદ બિન્દું તેમનાં કાચ્યો  
શાથે મોકલી આપ્યો તેમાટે તે એજિનો પણ આભારી હું  
મહાકાવ કાલદાસની કૃતિઓનાં અનુવાદમાટે નાંડ્યાએ  
શેખુંકેશન ચોસાચ્છીની કૌણ્શેના પુસ્તકાલયનો,  
અ. સૌભી ડાઇલાસ્ક્ષમી પુસ્તકાલયનો, ગુજરાત વિવાચાસાના  
ગ્રંથભાડાનો, ગુજરાત વિવાપીઠના કોપી વિભાગનો,  
મહારાજ સયાજીરાવ વેસ્ટ્વિવિદ્વાલયના પુસ્તકાલયનો મને  
ચાયેસ્ટ ઉપયોગ કરવા મળ્યો છે. તે માટે તે સંસ્થાઓના  
સંચાલકોનો પગુ ઉપકાર માર્યું હું. તે ઉપરાંત પ્રાણ્યાપક  
જર્યતકુમાર પુ. પટેલ, પ્રા. નરોત્તમભાઈ વાર્ણિક, પ્રા. કે.  
બી. શાહ, પ્રા.જીયેન્દ્રભાઈ જ્ઞિવેદી, પ્રા. ઐચ. એમ.

ઃ ૪૦.

મહેરા

સોણ વગેરેખે વડોદરા, કુરત, ભર્યાં, ખંખાત,  
માનગર વગેરે સ્થાનેનાં પુસ્તકાલયોમાંથી કાલકાશની  
કૃતિઓના અનુવાદોની માહિતી મોકલી આપી છે તે  
માટે તે સૌનો આસાર માનવાની એ તક લઈ છું.